

<http://suratiundhiyu.wordpress.com/>

BABA RAMADEV'S YOGA FOR VARIOUS DISEASES

બાબા રામદેવના વિવિધ રોગો માટેના આસનો

[LOOSE WEIGHT-વજન ઘટાડો](#)

[To Reduce Fat -ચરબી ઓછી કરવા](#)

[Yoga for the Youth-યુવાનો માટે](#)

[Yoga for Young Women-યુવાન યુવતીઓ માટે](#)

[Yoga for Obesity-સ્થૂળતા માટે યોગ](#)

[Yoga for Stomach Ailments-પેટના રોગો માટે આસનો](#)

[Yoga for Constipation & Piles-કબજિયાત અને હરસ માટે યોગ](#)

[Yoga for Diabetes-ડાયાબીટીસ માટે યોગ](#)

[Daily Yoga Aasans-Sunday-દરરોજ કરવાના યોગ](#)

[Yoga for Insomnia-અનિદ્રા માટે યોગ](#)

[Self - Realisation \(Atma Bodh\)](#)

[Yoga for Leucoderma-કોઢ માટે યોગ](#)

[Yoga for Migraine & Epilepsy-માથાના દુખાવા અને ખેંચ માટે યોગ](#)

[Yoga for Eye Diseases-આંખોના રોગો માટે યોગ](#)

[Yoga for Musculoskeletal Disorders \(Vaata Rog\)-વાયુનારોગો](#)

[Yoga for High Blood Pressure-હાઈબ્લડ પ્રેસર માટે યોગ](#)

[Reducing Belly Fat-પેટની ચરબી ઓછી કરવા માટે યોગ](#)

<http://suratiundhiyu.wordpress.com/>